



બ્રેમ્પટન રિક્રિએશન સેન્ટર્સમાં સપ્ટેમ્બર 1 થી શરૂ થતા ફોલ પ્રોગ્રામ્સ માટે રૂબરૂમાં નોંધણી કરાવો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 18, 2021) – સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 વૈશ્વિક મહામારી શરૂ થઈ ત્યારથી પહેલી વાર ફોલ (પાનખર ઋતુ) માટે નોંધાતા કાર્યક્રમો સુરક્ષિતપણે ફરીથી શરૂ કરી રહ્યું છે, જેમાં સપ્ટેમ્બર 20 થી શરૂ થતા કાર્યક્રમોની નોંધણી સપ્ટેમ્બર 1 થી શરૂ કરવામાં આવશે.

કાર્યક્રમો વેબસાઈટ www.brampton.ca/recreation પર ઓનલાઈન ઓગસ્ટ 28 થી જોઈ શકાશે. ઉપલબ્ધ કાર્યક્રમોમાં સ્વીમિંગ અને સ્કેટિંગ લેસન્સ, જીમનેસ્ટિક્સ, સ્પોર્ટ્સ રમવાનું શીખવાના કાર્યક્રમો, અને ઘણાં કાર્યક્રમો સામેલ છે! આ વર્ષે, બ્રેમ્પટન રિક્રિએશન બધાં નોંધાયેલા ફોલ પ્રોગ્રામ્સ માટે બે ટૂંકા સત્રો ચલાવશે, એક સપ્ટેમ્બર 20 થી નવેમ્બર 7 સુધી, અને અન્ય નવેમ્બર 8 થી ડિસેમ્બર 19 સુધી.

નોંધણી

સપ્ટેમ્બર 1 થી શરૂ થતી નોંધણી કરાવવા, 311 નંબર પર કોલ કરો અથવા [બ્રેમ્પટન રિક્રિએશનની ઓનલાઈન મુલાકાત લો](http://www.brampton.ca/recreation).

લોકો સીટી ઓફ બ્રેમ્પટન રિક્રિએશનના હાલના કે નવા એકાઉન્ટનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે. હાઉ-ટૂ ટ્યુટોરિયલ્સ યુઝર્સને માર્ગદર્શન આપવા ઉપલબ્ધ છે જેમાં કેવી રીતે [નવું એકાઉન્ટ સેટ-અપ કરવું](http://www.brampton.ca/recreation), [એક કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવવું](http://www.brampton.ca/recreation), [મેમ્બરશિપ ખરીદવી](http://www.brampton.ca/recreation), અને [ઘણું સામેલ છે](http://www.brampton.ca/recreation). જો તમને કોઈ પ્રશ્નો હોય તો, કૃપા કરી સહાયતા માટે અમારી ટીમને અહીં ઈમેઈલ મોકલો, recreation@brampton.ca. વૈકલ્પિક રીતે, રહેવાસીઓને નોંધણી સહાયતા માટે 311 (અથવા 905.874.2000 નંબર પર કોલ કરવા જો બ્રેમ્પટન બહાર રહેતા હો) પ્રોત્સાહિત કરવામાં આવે છે.

રૂબરૂમાં રજીસ્ટ્રેશન સિસ્ટમ ટ્રેઈનિંગ સેશન્સ આખા શહેરમાં ઓગસ્ટ 27 સુધી ઉપલબ્ધ છે. રહેવાસીઓને રજીસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો, પ્રશ્નો પૂછવા, અને ભાવિ સંદર્ભ માટે મદદરૂપ સૂચનો વિશે જાણવા દરેક વ્યક્તિની સિસ્ટમ સ્પેશિયાલિસ્ટ સાથે સામસામે એપોઈન્ટમેન્ટ માટે સાર્થક અપ કરવા આમંત્રિત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રિઝર્વેશન્સ [અહીં](http://www.brampton.ca/recreation) ઉપલબ્ધ છે.

COVID-19 આરોગ્ય અને સુરક્ષા ઉપાયો

હિમાયતીઓ, કર્મચારીગણ, અને સમુદાયની સુખાકારી એ સીટી ઓફ બ્રેમ્પટનની સર્વોત્તમ અગ્રતા બની રહેવાનું ચાલુ છે. અમે મુલાકાતીઓ અને કર્મચારીઓને યોજાવું અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા કટિબદ્ધ છીએ.

બ્રેમ્પટન રિક્રિએશન રિસેપ્શન વિસ્તારોમાં ઘટાડેલી ક્ષમતા, ફરજિયાત ફેસ માસ્ક્સ, સંરક્ષક અવરોધકો, અને રાયરચીલું/સાધનોના પુન:રૂપરેખાંકનને અમલમાં મૂકશે જેથી બધી સગવડો અને કાર્યક્રમો ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો અને પીલ પબ્લિક હેલ્થની આરોગ્ય અને સુરક્ષા માર્ગરેખાઓ અનુસરતા હોવાની ખાતરી કરી શકાય. આમાં સમગ્ર રિક્રિએશન સેન્ટર્સમાં સ્પર્શ બિંદુઓ પર અવારનવાર સફાઈ, સેનિટાઈઝર સ્ટેશન્સ, યોજાઈ તપાસવા સમર્પિત કર્મચારીગણ, અને બધાં કર્મચારીઓ માટે COVID-19 વિશિષ્ટ તાલીમનો પણ સમાવેશ થાય છે.



Service and Information Update

ਮਿਡਿਆ ਸੰਪਰਕ :

ਪ੍ਰਭਜੋਤ ਕੈਥ

ਕੋਆਰਡੀਨੇਟਰ, ਮਿਡਿਆ ਐਂਡ ਕਮਿਊਨਿਟੀ ਐਂਗੇਜਮੇਂਟ

ਵ੍ਹਾਟਸਥਪ ਸੰਵਾਦ

ਸੀਟੀ ਓਫ਼ ਬ੍ਰੈਂਪਟਨ

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca